

SAL SHAH ALLOYS LTD.

Corp. Office : Shah Alloys Corporate House, Sola - Kalol Road, Santej, Ta. Kalol, Dist. Gandhinagar- 382721
Regd. Office : 5/1, Shreeji House, 5th Floor, Behind M.J.Library, Ashram Road, Ahmedabad- 6. India
Phone : 02764 - 661100 | E-mail : info@shahalloys.com



31.05.2023

Department of Corporate Service
Bombay Stock Exchange Ltd.
Phiroze Jeejeebhoy Tower.
Dalal Street,
Mumbai – 400001

Manager
Listing Department
National Stock Exchange of India Ltd.
Exchange Plaza, Plot No C/1, G-Block,
Bandra – Kurla Complex, Bandra (E),
Mumbai – 400051

BSE Scrip Code: 513436

NSE Symbol – SHAHALLOYS

Dear Sir(s),

Subject: Submission of Newspaper Advertisement in Compliance with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

In terms of Regulation 47 & 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with corresponding circulars and notifications issued thereunder, we are enclosing herewith the Newspaper clippings from the “The Indian Express” (English Language) and “Financial Express” (Gujarati Language) editions for publication of Audited Financial Results of the Company for the Quarter & Year ended 31st March 2023.

You are requested to take the same on record and acknowledge the receipt of the same.

Thanking you.

Yours faithfully,
For Shah Alloys Limited

**Mayank
Chadha**

Digitally signed by Mayank Chadha
DN: c=IN, o=Personal,
2.5.4.20=070e6575be42b845aa66eef20c2e8
3687a7891a7911c0d8e8a12b0d04e6b0c,
postalCode=422020, st=Madhya Pradesh,
serialNumber=1b8240bb3025c1b0f4b212e5a7
12d77b6d25517847d55c551c896780c1e,
cn=Mayank Chadha
Date: 2023.05.31 15:38:28 +05'30'

Mayank Chadha
Company Secretary & Compliance Officer

Encl.: As mentioned above

CIN - L27100GJ1990PLC014698

Rajkot Nagarik Sahakari Bank Ltd. Notice for Sale

(Multistate Scheduled Bank)

R.O. & H.O.: 'Arvindbhai Maniar Nagark Sevayal', 150' Ring Road, Nr. Raiya Circle, Rajkot, Ph. 2555716

In terms of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (SARFAESI Act-2002) Pursuant to the possession of the property described herein below is taken by the Authorized Officer on 11/03/2023 under SARFAESI Act-2002 for recovery of the secured debts of Rajkot Nagarik Sahakari Bank Ltd. from Dhanubhai Dineshbhai Dabral. OFFERS are invited by the undersigned in sealed cover for purchase of this property within 30 days from the date of this Notice, brief particulars of which is given hereunder on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS". For inspection of the property and tender form, one can contact us at Rajkot Nagarik Sahakari Bank Ltd., Arvindbhai Maniar Nagark Sevayal, Recovery Department, Head Office, 150 Feet Ring Road, Near Raiya Circle, Rajkot Or Upleta Branch, (Branch Address: Dhadar Road, Upleta).

*** Date fixed for inspection of the property: 21.06.2023 (11:00 AM To 4:00 PM)**
*** Last Date for submission of tender: 07.07.2023 (Up to 04:00 PM)**
*** Date, Time & Place of Opening the tenders: 10.07.2023, 11:00 AM. At 'Arvindbhai Maniar Nagark Sevayal', 150' Ring Road, Nr. Raiya Circle, Rajkot.**

Description of Property	Total Dues	Reserve Price	Amount of Deposit
Immovable property situated at Rajkot Dist., Sub-Dist. Upleta, within the boundary of Upleta Corporation at Koiik Road, for residential purpose Geetaanjali Society Revenue Survey No. 316 Paiki Plot No. 12 on North side addressing land area 99' 7 Sq. Meters alongwith future construction approved vide Regd. Sale Deed No. 234, Dated 13/03/1991 in the name of Nautamial Nathalal Javia and bounded by as under:- North - On that side Road South - On that side plot/paik land of Other's Ownership East - On that side adjoining land of Other's Ownership West - On that side Plot No. 11 of Other's Ownership (Short Address - "Bansidhar", Block No. 8, Nildhara Society, Opp. Police Station, Koiik Road, Upleta)	Rs. 20,43,652.00 + unapplied interest w.e.f. 01/05/2023 + Legal Expense	Rs. 23,26,500/-	Rs. 2,32,650/-

Terms & Conditions: 1. The immovable property is to be sold on 'As is where is' and 'As is what is' basis. 2. The purchaser will have to pay any type of Govt. dues / Sem. Govt. dues / Municipal taxes / Electricity Bills etc., if any, due on this property. If any document relating to this property is pending for payment of stamp duty, the purchaser will have to pay the same. 3. In the court cases, if any, relating to this Property, the orders of the court, would be binding to the purchaser. 4. The tenderer can bid for any amount, but he is to submit a Banker's Cheque/Demand draft of 10% of Reserve Price as deposit, as mentioned above payable to Rajkot Nagarik Sahakari Bank Ltd., Rajkot with the tender. 5. One can get tender form from the undersigned or from Upleta Branch. 6. The Bank reserves its right to accept or reject any tender. It may not be sold below reserve price. 7. The tenderer will be required to pay 25% of the bid price on acceptance of his tender (10% of the reserve price submitted with the tender will be taken into account) & if the successful tenderer will fail to pay the accepted bid price, the amount of deposit will be forfeited by the Bank. 8. On acceptance of the tender the amount of deposit will be refunded without any interest thereon. 10. The authorized officer does hereby state that, the bank is not aware about any charge or tax or liability for the said property. However, the bidder shall ensure by his own sources to find out any charges, lien, encumbrance, property tax, Government dues in respect of the property and the same shall be the responsibility of the tenderers.
***30 days Statutory Sale notice to the Borrower, Guarantors & Mortgagee.**
***Prospective buyer may also visit our website www.msindia.com for sale advertisement**

Dt. 30/05/2023
Rajkot. Authorized Officer, Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O., Recovery Dept., Rajkot.

GOVERNMENT OF ODISHA

OFFICE OF THE CHIEF CONSTRUCTION ENGINEER
RURAL WORKS CIRCLE: SUNDARGARH

ATPO-SANKARA, SUNDARGARH-70202. Email: sdwrc_sundargarh@yahoo.com

No. Tender Online- RWOCESND-04 of 2023-24. Letter No. 1306/DtS. 28/05/2023

e-Procurement NOTICE

1. Type of the Work : Roads (DMIF)
2. Class of Contractor : As specified in the column-6 of the Annexure
3. Time of Completion : As specified in the column-5 of the Annexure
4. Detail Projects : As per Annexure attached-4
5. Estimated Cost : As specified in the column-4 of the Annexure
6. Other Details :

Procurement Officer	Bid Identification No.	Availability of Tender on-line for bidding		Last Date & Time of Sealing tender	Date & Time of opening of tender	
		From	To		Technical Bid	Financial Bid
Chief Construction Engineer, Rural Works Circle, Sundargarh	RWOCESND-04 of 2023-24	06.06.2023 11:00 AM	06.06.2023 5:00 PM	27.06.2023 3:00 PM	27.06.2023 11:00 AM	Will be intimated separately

Further details can be seen from the website www.tendersodisha.gov.in
Sd/- Chief Construction Engineer
Rural Works Circle, Sundargarh
O.P.Nr- 25/13/11/00/102324

TORRENT PHARMA

TORRENT PHARMACEUTICALS LIMITED
Registered Office:
Torrent House, Off Ashram Road,
Ahmedabad - 380 009, Gujarat, India.
Ph. : 91 79 26599000
Fax : 91 79 26582100

CIN: L24230GJ1972PLC02126
Website: www.torrentpharma.com
Email: investorserveks@torrentpharma.com

Extract of Consolidated Financial Results for the Quarter and Year ended 31-Mar-2023

(₹ in crores except per share data)

Particulars	Quarter Ended 31-Mar-2023	Year Ended 31-Mar-2023	Quarter Ended 31-Mar-2022
	Audited (Refer Note 2)	Audited	Audited (Refer Note 2)
Total Income from operations (net)	2491	9620	2131
Net Profit / (Loss) for the period before tax and exceptional items	433	1847	398
Net Profit / (Loss) for the period before tax and after exceptional items	433	1847	(87)
Net Profit / (Loss) for the period after tax and exceptional items	287	1245	(118)
Total Comprehensive Income (after tax)	330	1108	(107)
Equity Share Capital	169.23	169.23	84.62
Other Equity excluding Revaluation Reserve			
Earnings per share (of ₹ 5/- each) (Refer Note 3)			
Basic	8.48	36.79	(3.49)
Diluted	8.48	36.79	(3.49)

* Other Equity excluding Revaluation Reserve as on 31-Mar-2022 was ₹ 5868 crores.

Notes:
1. Summary details of stand-alone audited financial results of Torrent Pharmaceuticals Limited :
(₹ in crores)

Particulars	Quarter Ended 31-Mar-2023	Year Ended 31-Mar-2023	Quarter Ended 31-Mar-2022
Net income from operations	1920	7695	1662
Profit before tax	328	1577	345
Profit after tax	219	1052	221
Total Comprehensive Income (after tax)	240	974	219

2. The figures for the quarter ended 31-Mar-2023 and 31-Mar-2022 is the balancing figures between audited figures in respect of the full financial year and for the period upto the end of the third quarter ended 31-Dec-2022 (as restated to give effect of amalgamation as per Note 4) and 31-Dec-2021, respectively, which were subject to limited review.

3. Pursuant to approval given by its shareholders, the company has during the year ended 31-Mar-2023, issued 16,92,22,720 equity shares of ₹ 5/- each as fully paid-up bonus equity shares in the ratio of 1 (one) equity share for every 1 (one) existing equity share. Accordingly, the earnings per share has been adjusted for previous periods and presented in accordance with Ind AS 33 - Earnings Per Share.

4. On 14-Oct-2022, the Company acquired 100% shares of Curatio Healthcare (I) Private Limited ("Curatio"), including its two subsidiaries: The Board of Directors of the Company, at its meeting held on 21-Dec-2022, had approved the Scheme of Arrangement in the nature of Amalgamation of Curatio with the Company. The scheme was approved by the National Company Law Tribunal ("NCLT"), Ahmedabad Bench on 17-May-2023 with the appointed date of 14-Oct-2022. The financial statements for the quarter and year ended 31-Mar-2023 are after giving effect to the amalgamation in books of accounts. Hence, the quarter ended figures, to that extent are not comparable.

5. The Board of Directors in their meeting held on 30-May-2023, recommended a final equity dividend of ₹ 8/- per equity share.

6. The above is an extract of the detailed format of Financial Results for the quarter and year ended 31-Mar-2023 filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same, along with the notes, are available on www.msindia.com, www.bsindia.com and on the Company's website www.torrentpharma.com

Place : Mumbai, Maharashtra
Date : 30-May-2023

JINDAL WORLDWIDE LIMITED

CIN: L7110GJ1986PLC008942
Regd. & Corp. Office: Dindal House", Opp. Dindal, I.O.C Petrol Pump Lane, Shrawanji Shyamal 132 F Ring Road, Saleitole, Ahmedabad - 380015
Phone: 079-71001500 • E-Mail: cs.jindal@jindalworldwide.com • Website: www.jindalworldwide.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS (as Per Regulation 33 of SEBI (LODR) Regulation, 2015, SCHEDULE III OF COMPANIES ACT, 2013 And IND-AS) For the Quarter & Financial Year ended 31st March 2023 (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015)

Sl. No.	Particulars	Quarter Ended		Year Ended	
		3 months ended 31st March 2023 (Un-Audited) (Refer Note No. 7)	Preceding 3 months ended 31st March 2022 (Audited) (Refer Note No. 7)	Current Financial Year ended 31st March 2023 (Audited)	Previous Financial Year ended 31st March 2022 (Audited)
STANDALONE					
1.	Total Income from operations (net)	56616,24	14301,93	75785,88	214902,04
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	3448,17	2470,17	4663,55	15195,72
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	3448,17	2470,17	4663,55	14453,42
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	2565,93	1725,77	3502,12	11411,09
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2616,34	1725,77	4407,24	11461,50
6.	Equity Share Capital	2005,20	2005,20	2005,20	2005,20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2022 and Current Financial Year ended 31st March 2023	NA	NA	NA	62699,39
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1,28	0,86	1,75	5,69
	2. Diluted	1,28	0,86	1,75	5,69
CONSOLIDATED					
1.	Total income from operations (net)	54945,84	40377,95	72850,98	207001,40
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	3559,37	2169,15	4688,47	15404,95
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	3559,37	2169,15	4688,47	14637,54
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	2653,01	1476,08	3452,43	11571,67
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2703,42	1476,08	4357,55	11622,08
6.	Equity Share Capital	2005,20	2005,20	2005,20	2005,20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2021 and Current Financial Year ended 31st March 2022	NA	NA	NA	62992,59
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1,32	0,74	1,72	5,77
	2. Diluted	1,32	0,74	1,72	5,77

Notes: 1. The above Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter and financial year ended 31st March, 2023 have been reviewed by the Audit Committee and are approved by the Board of Directors in the Meeting held on 30th May, 2023.

2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 ("Ind-AS") from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended). Further, all the applicable amendments stated in the Schedule III of the Companies Act, 2013 has also been adopted and presented in the Financial Statements for the period ended 31st March, 2023.

3. The Board of Directors in its meeting held on 30th May, 2023 have recommended a Final Dividend of 20% of the paid up equity share capital (i.e. Rs. 2.00 paise per equity share of Rs. 1/- each) for the Financial Year 2022-2023.

4. The Statutory Auditors of the Company have carried out an Audit of the above Standalone & Consolidated Financial Results & Statement of Assets & Liabilities of the Company for the quarter and financial year ended 31st March, 2023 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Independent Auditor's Report thereon.

5. The figures for the corresponding previous periods have been restated/regrouped wherever necessary, to make them comparable.

6. Pursuant to SEBI Circular No. SEBI/HO/DDHS/CIR/P2018/144 dated 28th November, 2016 "Fund Raising by Issuance of Debt Securities by Large Entities", the Company do not fall under the category of Large Corporates as per the applicability framework of the said circular as on 31st March, 2023 for the Financial Year 2022-2023.

7. The financial results for the quarter ended 31st March, 2023 forming part of the statement of Audited Standalone & Consolidated Financial Results are the balancing figure between the audited figures in respect of the full financial year ended on 31st March, 2023 and the published year to date un-audited figures up to the third quarter of the financial year under review i.e. 31st December, 2022, which were subject to limited review by the Statutory Auditor's thereon.

8. The above is an extract of the detailed format of Audited Standalone & Consolidated Financial Results for the quarter & Financial Year ended on 31st March, 2023 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results alongwith Statement of Assets and Liabilities and Cash Flow Statement alongwith Standalone & Consolidated Independent Auditor's Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindalworldwide.com).

For and on Behalf of the Board
JINDAL WORLDWIDE LIMITED
Sd/-
(MR. AMIT AGRAWAL)
Vice Chairman & Managing Director
DIN : 00169061

Date : 30th May, 2023
Place : Ahmedabad

Gujarat Water Supply and Sewerage Board, TENDER NOTICE NO. 03 OF 2023-24 (2nd Attempt) TENDER ID : 1. 596081 2. 596086 3. 596087

Executive Engineer, P.H. Mechanical Dn, GWSSB, 35/B, Nirmal Society, Behind Gopal Guest House Nr. College Chhotaudapur, Phone:997840661) in its online tenders for the work of 1. Drilling of 165 mm dia. bore by DTH Rig at diff. villages of Taluka, Chhotaudapur and Jetruparvi 2. (Esti. Amt Rs. 49.83 Lack) 2. Drilling of 165 mm dia. bore by DTH Rig at diff. villages of Taluka, Kawant (Esti. Mt. Rs. 48.83 Lack) 3. Drilling of 200 mm dia. bore by DR Rig at diff. village of All Taluka of Dist Chhotaudapur (Esti. Amt Rs. 9.15 Lack) from those who are registered contractor/agency Drilling from GWSSB/GWRDC also mentioned Eligibility Criteria mentioned in the Tender document. Further details can be made available on web site www.nprocure.com/ www.gwssb.nprocure.com. The last date of tender download/uploading is Dtd :06/06/2023 to 18.00 hrs. Further amendment mad will be disubrs only on www.nprocure.com web site only.
Note: - Contact GWSSB Toll Free Help Line No. 1916 for any complaint of drinking water in rural area.
(INF-VAD-294-23-24)

Rajkot Nagarik Sahakari Bank Ltd. Public Notice

R.O. & H.O.: 'Arvindbhai Maniar Nagark Sevayal', 150' Ring Road, Nr. Raiya Circle, Rajkot, Ph. 2555555

The undersigned being the authorized officer of the Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O. Rajkot under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 Section 13(2) and in exercise of powers conferred under the Security Interest (Enforcement) Rules, 2002 Issued a demand notices by Regd A.O.Pret to the following borrower and his Guarantors calling upon them to repay the amount mentioned in the notice with due interest thereon within 60 days from the date of receipt of the said notice. However for the reason whatsoever, certain notices are returned undelivered. Therefore this public notice is given to the following Borrower and his Guarantors advising them to repay the dues of the banks with due interest thereon within 60 Days from the date of this notice and if they will fail to repay the same, the bank will take further actions including taking possession of the securitized properties mentioned in this notice, as per the provisions of above acts.

Branch Name	Nature of Facility & Loan Account No.	Borrower Name and Address	Guarantor's Name and Address	N.P.A. Date & Interest Rate	Outstanding Amount Rs.
Surenדרanagar Branch	NAGARIK LAGHU UDVOG VEPAR LOAN 50/71/71/21550 (SEC/4332)	Borrowers : Zala Ranjanba Pravinieinh Hadima Road, Near Bari, Near Rankadevi Temple, Wadhwan, Surenדרanagar - 363030 (Gujarat)	(1) Dave Devarshi Rohitbhai, Hadima Road, Near Bari, Near Rankadevi Temple, Wadhwan Surenדרanagar - 363030 (Gujarat) (2) Zala Yogendra Pravinieinh, Hadima Road, Near Bari, Near Rankadevi Temple, Wadhwan Surenדרanagar - 363030 (Gujarat) (3) Zala Sahdevsinh Pravinieinh, Hadima Road, Near Bari, Near Rankadevi Temple, Wadhwan Surenדרanagar - 363030 (Gujarat) (4) Zala Ashokbhai Pravinieinh, Hadima Road, Near Bari, Near Rankadevi Temple, Wadhwan Surenדרanagar - 363030 (Gujarat)	30/04/2023 PLR-2.26% (11.50%)	(As on 30/04/2023) Principal : 4,90,596/- Interest : 11,630.00 Charges : 00/- Total Amount : 5,02,226.00

Description of Properties
(1) Immovable property situated in Surenדרanagar Dist., Sub-Dist. Surenדרanagar, Taluka Wadhwan, Village Wadhwan Sudhrai Boundary in Hadima Road, Wadhwan City Survey Ward No. 1 in City Survey No. 619 Paik North side Portion addressing area approx. 39.2550 Sq. Meter alongwith Construction thereon with Future Construction approved vide Regd. Sale Deed No.3596 Dated 30/10/2010 in the name of (1) Zala Ranjanba Pravinieinh (2) Zala Yogendra Pravinieinh (3) Zala Sahdevsinh Pravinieinh (4) Zala Ashoksinh Pravinieinh
(2) All Stocks of goods, machinery furniture & fixtures, vehicles, computer etc. of the firm / company.

Dt. 30-05-2023, Rajkot Authorized Officer, Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O., Recovery Department, Rajkot.

SAL SHAH ALLOYS LIMITED

Regd Off: 5/1, Shreeji House, B/h M.J. Library, Ashram Road, Ahmedabad - 380 006
CIN: L27100GJ1990PLC014698 Website: www.shahalloys.com

Extract of Audited Financial Results for the Quarter and Year ended March 31, 2023 (pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015)

(Rs. in crore except per share data)

Sr. No.	Particulars	STANDALONE				CONSOLIDATED			
		31.03.2023 (AUDITED)	31.03.2022 (AUDITED)	31.03.2023 (AUDITED)	31.03.2022 (AUDITED)	31.03.2023 (AUDITED)	31.03.2022 (AUDITED)	31.03.2023 (AUDITED)	31.03.2022 (AUDITED)
1	Total Income	153.65	257.91	639.10	906.91	153.65	257.91	627.94	886.15
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	(12.96)	25.40	5.33	130.12	(8.66)	32.48	(5.83)	109.36
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or extraordinary items)	(12.96)	25.40	5.33	130.12	(8.66)	32.48	(5.83)	109.36
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or extraordinary items)	(10.89)	21.56	6.67	102.87	(6.59)	28.64	(4.49)	82.11
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(10.23)	21.43	7.31	102.84	(5.71)	28.51	(2.59)	82.08
6	Equity Share Capital	19.80	19.80	19.80	19.80	19.80	19.80	19.80	19.80
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	37.71	-	-	-	-	13.27
8	Earning Per Share (of Rs, 10/-each) (for continuing and discontinued operations) -								
	1. Basic:	(5.50)	10.89	3.37	51.96	(3.21)	14.46	(1.63)	41.47
	2. Diluted:	(5.50)	10.89	3.37	51.96	(3.21)	14.46	(1.63)	41.47

Note:
1. The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results are available on the Stock Exchange websites viz. www.bsindia.com and www.nseindia.com and on Company's website viz. www.shahalloys.com

For and on behalf of Board of Directors
Sd/-
For Shah Alloys Limited
Ashok Sharma (DIN : 0008360)
Director & CFO

Place : Santaj
Date : 29.05.2023



TORRENT PHARMACEUTICALS LIMITED
Registered Office:
Torrent House, Off Ashram Road,
Ahmedabad - 380 009, Gujarat, India.
Ph. : + 91 79 26599000
Fax : + 91 79 26582100

Extract of Consolidated Financial Results for the Quarter and Year ended 31-Mar-2023. Table with columns: Particulars, Quarter Ended 31-Mar-2023, Year Ended 31-Mar-2023, Quarter Ended 31-Mar-2022, Year Ended 31-Mar-2022.

* Other Equity excluding Revaluation Reserve as on 31-Mar-2022 was ₹ 5868 crores.
Notes:
1. Summary details of stand-alone audited financial results of Torrent Pharmaceuticals Limited :

Table with columns: Particulars, Quarter Ended 31-Mar-2023, Year Ended 31-Mar-2023, Quarter Ended 31-Mar-2022, Year Ended 31-Mar-2022.

2. The figures for the quarter ended 31-Mar-2023 and 31-Mar-2022 is the balancing figures between audited figures in respect of the full financial year and for the period up to the end of the third quarter ended 31-Dec-2022 (as restated to give effect of amalgamation as per Note 4) and 31-Dec-2021, respectively, which were subject to limited review.
3. Pursuant to approval given by its shareholders, the company has during the year ended 31-Mar-2023, issued 16,922,270 equity shares of ₹ 5/- each as fully paid-up bonus equity shares in the ratio of 1 (one) equity share for every 1 (one) existing equity share. Accordingly, the earnings per share has been adjusted for previous periods and presented in accordance with Ind AS 33, Earnings Per Share.
4. On 14-Oct-2022, the Company acquired 100% shares of Curatio Healthcare (I) Private Limited ('Curatio'), including its two subsidiaries. The Board of Directors of the Company, at its meeting held on 21-Dec-2022, had approved the Scheme of Arrangement in the nature of Amalgamation of Curatio with the Company. The scheme was approved by the National Company Law Tribunal ('NCLT'), Ahmedabad Bench on 17-May-2023 with the appointed date of 14-Oct-2022. The financial statements for the quarter and year ended 31-Mar-2023 are after giving effect to the amalgamation in books of accounts. Hence, the quarter ended figures, to that extent are not comparable.
5. The Board of Directors in their meeting held on 30-May-2023, recommended a final equity dividend of ₹ 8/- per equity share.
6. The above is an extract of the detailed format of Financial Results for the quarter and year ended 31-Mar-2023 filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same, along with the notes, are available on www.nseindia.com, www.bseindia.com and on the Company's website www.torrentpharma.com.
Place : Mumbai, Maharashtra
Date : 30-May-2023

PRASHANT INDIYA LIMITED
REGD. OFFICE: BLOCK NO 45B PALSANA CHHARASTA PALSANA DIST SURAT GJ 394135 PH-728086658
CIN:L15142GJ1983PLC001274. Email: info@prashantindia.com, Website: www.prashantindia.com
STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31.03.2023

SUMEEET INDUSTRIES LIMITED
EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31/03/2023

Table with columns: Sr. No, Particulars, QUARTER ENDED 31/03/2023, YEAR ENDED 31/03/2023.

NOTE -
1. The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended 31.03.2023.
2. The Corporate Insolvency Resolution Process ('CIRP') of Summeet Industries Limited ('SIL') has been initiated vide the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench (NCLT), order dated 20.12.2022, under Section 7 of the Insolvency and Bankruptcy Code, 2016 ('IBC', Code 16) filed by IBI Bank Limited, Mr. Satyendra P. Khoriaani (Reg. No. IBB/PIA-002/PI-ND00020216-17/0002) has been appointed as Resolution Professional ('RP') of the company.

Parshwanath Corporation Ltd
REGD. OFFICE: 50 Hatichamb Chambers, 2/F, Pico, Ashram Road, Ahmedabad-380014
AUDITED FINANCIAL RESULTS FOR QUARTER & YEAR ENDED ON MARCH 31, 2023

લોડર્સ ધર્મર દોલેલ લીમિટેડ
સર્ક. નો. 00126 (વિદેશી), સર્કાર યુવન યુવન, અમદાવાદ-૩૮૦૦૧૩, પુર્વ-વેસ્ટી રોડ, વલ્લભ, ગુજરાત.
CIN: L55100GJ1983PLC002828 (વેબસાઇટ: www.loarders.com)

kotak
Kotak Mahindra Bank
આવક અને ખર્ચ સંબંધિત માહિતી: 1.5511 (MM) (વેબસાઇટ: 000370)
વેબસાઇટ: www.kotak.com

કોટક મહાનંદરા બેંક લિમિટેડ
આવક અને ખર્ચ સંબંધિત માહિતી: 1.5511 (MM) (વેબસાઇટ: 000370)
વેબસાઇટ: www.kotak.com

HINDPRAKASH INDUSTRIES LIMITED
CIN: L24100GJ2008PLC055401 Reg. Office: 301, 'HINDPRAKASH HOUSE', PLOT NO. 10/6, PHASE - 1, GIDC, VATVA, AHMEDABAD- 382445
Tel: 079-68127000, Fax: 079-68127096, Email: info@hindprakash.com, Website: www.hindprakash.in

SHAH ALLOYS LIMITED
Regd Off: 5/1, Shreeji Avenue, B'h M.J. Library, Ashram Road, Ahmedabad - 380 006
CIN: L27100GJ1990PLC014698 Website: www.shahalloys.com
Extract of Audited Financial Results for the Quarter and Year ended March 31, 2023